


Title Clear Report

AVANISH BUILDERS




PARTNER

V. M PATEL

(B.Com.LL.B., B.J.M.C.)

ADVOCATE(Gujarat High Court)

218, Ashish Com. Complex, Near Astron Cinema, Sardarnagar Main
Road, Rajkot-360001 : Ph.: 0281- 2482787



V. M PATEL

(B.Com.LL.B., B.J.M.C.)

ADVOCATE(Gujarat High Court)

218, Ashish Com. Complex, Near Astron Chowk, Sardarnagar Main Road, Rajkot-360001 : Ph.: 0281- 2482787, MO. 98250 77078

બાબત :- સ્થાવર મિલ્કતનો ટાઈટલ તથા સર્ચ રીપોર્ટ

મે. અવનીશ બિલ્ડર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીની માલીકીની સ્થાવર મિલ્કતની ફોટોકોપી નકલો સહીતની ફાઈલ મારી સમક્ષ ટાઈટલ રીપોર્ટ અંગે રજુ રાખી અને અપાયેલ મૌખિક સુચના અન્વયે ટાઈટલ રીપોર્ટ.

સ્થાવર મિલ્કતના માલીક : મે. અવનીશ બિલ્ડર્સ ભાગીદારી પેઢીના વહીવટકર્તા ભાગીદાર શ્રી ચતુરભાઈ રામજીભાઈ પટેલ

(૧) રાજકોટ શહેરમાં સમાવિષ્ટ ગામ મવડીના રેવન્યુ સર્વે નં.૨૫૧ પૈકી ની જમીન એકર ૩-૧૭ ગુઠાના રહેણાંકના હેતુ માટે બીનખેતી જમીન કે જે " અંબીકા પાર્ક " ના નામથી ઓળખાતા પ્લોટસ પૈકી પ્લોટ નં.૮ ની જમીન ચોરસ મીટર આ.૩૮૮-૧૫, ચોરસ વાર આ.૪૬૪-૨૪ મંજુર થયેલ બીલ્ડીંગ પ્લાન સહીતની માલીકી મે. અવનીશ બિલ્ડર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીની આવેલ છે.તથા સદરહું મિલ્કતના ઉતરોતર ટાઈટલ ડીડઝની ફોટોકોપી નકલો સહીતની ફાઈલ ટાઈટલ તથા સર્ચ રીપોર્ટ અંગે મારી સમક્ષ રજુ કરેલ છે.

(૨) મિલ્કતની વિગત :-

રાજકોટ શહેરમાં સમાવિષ્ટ ગામ મવડીના રેવન્યુ સર્વે નં.૨૫૧ પૈકીની જમીન એકર ૩-૧૭ ગુઠાના રહેણાંકના હેતુ માટે બીનખેતી જમીન કે જે " અંબીકા પાર્ક " ના નામથી ઓળખાતા પ્લોટસ પૈકી પ્લોટ નં.૮ ની જમીન ચોરસ મીટર આ.૩૮૮-૧૫, ચોરસ વાર આ.૪૬૪-૨૪ જેના ટી.પી. નં.૨૮(ડ્રાફ્ટ), એફ.પી. નં.૧ પૈકી આવેલ છે. જેની ચતુર્સિમા નીચે મુજબ છે.

ઉતરે :- સરકારી ખરાબો આવેલ છે.તે તરફ માપ મીટર ૩૦-૭૦ છે.

દક્ષિણે :- પ્લોટ નં.૮ ની જમીન આવેલ છે.તે તરફ માપ મીટર ૨૮-૧૩ છે.

પૂર્વે :- સર્વે નં.૧૮૪ પૈકી આવેલ છે.તે તરફ માપ મીટર ૧૦-૧૧ છે.

પશ્ચિમે :- ૭-૫૦ મીટર પહોળો રસ્તો આવેલ છે.તે તરફ માપ મીટર ૧૬-૫૦ છે.

(૩) સદરહું સ્થાવર મિલ્કતના ઉતરોતર ટાઈટલ ડીડઝ નીચે મુજબ છે.

૧:: ટીપણની ખરીનકલ.

૨:: અનુક્રમ નં.૪૦૮૬ તા.૦૮/૦૪/૧૯૯૨ ના શ્રી ગોરધન લવા વિગેરે જોગ શ્રી વિરજીભાઈ પ્રેમજીભાઈએ કરી આપેલ વેચાણ દસ્તાવેજની ખરીનકલ.

...૨...

AVANISH BUILDERS

PARTNER



॥ ૨ ॥

- ૩:: શ્રી ગોરધનભાઈ લવાભાઈ વિગેરેએ તા.૦૮/૦૬/૧૯૯૩ ના શ્રી આનંદ નીતીનભાઈ મહેતા તથા શ્રી દાનુભા ગુમાનસિંહ જાડેજાને લખી આપેલ કુલમુખત્યારનામાની નોટરી ટુ કોપી.
- ૪:: અધિક કલેક્ટર કચેરી, શહેરી જમીન ટોચ મર્યાદા, રાજકોટના હુકમ નં.યુએલસી/૬(૧)૪૩૮૭ તા.૧૮/૧૦/૧૯૯૩ ની ખરીનકલ.
- ૫:: રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના પત્ર નં.૩૬/ટિક/ડેવ/મવડી/૭૪૨/૯૪ તા.૩૧/૧૨/૧૯૯૪ ની નોટરી ટુ કોપી.
- ૬:: બીનખેતી લે-આઉટ પ્લાનની નોટરી ટુ કોપી.
- ૭:: કલેક્ટર કચેરી રાજકોટના બીનખેતી હુકમ નં.એનએ-લેરેકોક-૬૫-કેસ નં.૨૨/૯૪-૯૫/વશી/૮૦૬ થી ૮૧૫/૯૫ તા.૦૪/૦૩/૧૯૯૫ ની ખરીનકલ.
- ૮:: બીનખેતી સનંદ અંગેનો દાખલો અસલ.
- ૯:: અધિક કલેક્ટર કચેરી, શહેરી જમીન ટોચ મર્યાદા, રાજકોટના હુકમ નં.યુ.એલ.સી.૨૬/૧૭૪૮/૯૫ તા.૨૭/૧૧/૧૯૯૫ ની ખરીનકલ.
- ૧૦:: અધિક કલેક્ટર કચેરી, શહેરી જમીન ટોચ મર્યાદા, રાજકોટના પત્ર નં.યુએલસી.૨૬/૧૭૪૮/૯૫ તા.૨૬/૧૨/૧૯૯૫ ના સુધારા હુકમની ખરીનકલ.
- ૧૧:: અનુક્રમ નં.૧૮૦૮૪ તા.૧૧/૧૨/૧૯૯૫ ના શ્રી મનોજકુમાર ત્રિભોવનભાઈ પટેલ વિગેરે જોગ શ્રી ગોરધનભાઈ લવાભાઈ વિગેરેના કુલમુખત્યાર દરજજે શ્રી દાનુભા ગુમાનસિંહ જાડેજાએ કરી આપેલ વેચાણ દસ્તાવેજની ખરીનકલ.
- ૧૨:: શ્રી મનોજભાઈ ત્રિભોવનભાઈ પટેલ તથા શ્રી હિતુભા કરણસિંહ જાડેજાએ તા.૩૦/૦૩/૧૯૯૬ ના શ્રી આનંદ નીતીનચંદ્ર મહેતા તથા શ્રી પંકજ હિંમતલાલ પારેખને લખી આપેલ કુલમુખત્યારનામાની નોટરી ટુ કોપી.
- ૧૩:: અનુક્રમ નં.૭૭૨૩ તા.૧૩/૧૦/૨૦૦૫(તા.૨૮/૧૦/૨૦૦૫) ના શ્રી મનહરભાઈ નાથાભાઈ સાદરીયા જોગ શ્રી મનોજકુમાર ત્રિભોવનભાઈ પટેલ વિગેરેના કુલમુખત્યાર દરજજે શ્રી આનંદ નીતીનચંદ્ર મહેતાએ કરી આપેલ વેચાણ દસ્તાવેજ અસલ.
- ૧૪:: અનુક્રમ નં.૧૯૮૪૮ તા.૨૩/૧૨/૨૦૦૮ ના શ્રી મનહરભાઈ નાથાભાઈ સાદરીયા જોગ શ્રી મનોજકુમાર ત્રિભોવનભાઈ પટેલ વિગેરેના કુલમુખત્યાર દરજજે શ્રી આનંદ નીતીનચંદ્ર મહેતાએ કરી આપેલ ચુકસુધારા દસ્તાવેજ અસલ.
- ૧૫:: અનુક્રમ નં.૧૯૮૪૨ તા.૨૩/૧૨/૨૦૦૮ ના શ્રી પ્રજાબેન રમણીકલાલ ગોલ જોગ શ્રી મનહરભાઈ નાથાભાઈ સાદરીયાએ કરી આપેલ વેચાણ દસ્તાવેજ અસલ.
- ૧૬:: શ્રી પ્રજાબેન રમણીકલાલ ગોલના નામના રેવન્યુ રેકર્ડ ગામ નમુનો નં.૮-અ ના ખાતા નં.૧૭૬૮, ગામ નમુનો નં.૬ હકકપત્રક નોંધ પ્રમોલગેશન તથા ૭/૧૨ ની ખરીનકલ.
- ૧૭:: તા.૧૩/૦૪/૨૦૧૮ ના રોજ મહેસુલ લીઝ ભરપાઈ રીસીપ્ટ અસલ.
- ૧૮:: ટી.પી. નં.૨૮(મવડી), એફ.પી. નં.૧ ના હિસ્સા ફોર્મની ખરીનકલ.
- ૧૯:: ટી.પી. નં.૨૮(મવડી), એફ.પી. નં.૧ ના સ્કેચની ખરીનકલ.
- ૨૦:: રૂડા પાર્ટ પ્લાનની ખરીનકલ.
- ૨૧:: રૂડા ઝોનીંગ સર્ટીફિકેટની ખરીનકલ.

ANCH BUILDERS
PARTNER



॥ ૩ ॥

63
13

- ૨૨:: મે. અવનીશ બિલ્ડર્સ ભાગીદારી પેઢીના તા.૬/૪/૨૦૧૮ ના ભાગીદારી દસ્તાવેજની નકલ.
- ૨૩:: અનુક્રમ નં.૩૦૨૯ તા.૨૬/૦૪/૨૦૧૮ ના મે. અવનીશ બિલ્ડર્સ ભાગીદારી પેઢી જોગ શ્રી પ્રજાબેન રમણીકલાલ ગોલએ કરી આપેલ વેચાણ દસ્તાવેજ અસલ.
- ૨૪:: મે. અવનીશ બિલ્ડર્સ ભાગીદારી પેઢીના નામના ગામ નમુનો નં.૨ ની ખરીનકલ.
- ૨૫:: અનુક્રમ નં.૪૩૧૨ તા.૨૧/૦૬/૨૦૧૮ ના મે. અવનીશ બિલ્ડર્સ ભાગીદારી પેઢી જોગ શ્રી પ્રજાબેન રમણીકલાલ ગોલએ કરી આપેલ ચુકસુધારા દસ્તાવેજ અસલ.
- ૨૬:: મે. અવનીશ બિલ્ડર્સ ભાગીદારી પેઢીના નામના સીટી સર્વે વોર્ડ નં. ટીપી-૨૮ મવડી, સીટી સર્વે નં.૧/૯ ના પ્રોપર્ટીકાર્ડની ખરીનકલ.
- ૨૭:: રાજકોટ મ્યુનિ. કોર્પો. એ મંજૂર કરેલ બીલ્ડીંગ પ્લાન અસલ.
- ૨૮:: રાજકોટ મ્યુનિ. કોર્પો. ની ઓનલાઈન ફોર્મ નં.ડી ડેવલોપમેન્ટ પરમીશન નં.RMC/31-08-2018/733922/01/001409 Dt.31/08/2018 અસલ.
- ૨૯:: સબ રજીસ્ટ્રાર કચેરી, રાજકોટના ઝોન-૨ તથા ઝોન-૬ ની છેલ્લા ૧૭ વર્ષની શોધની પહોંચો તા.૧૦/૧૨/૨૦૧૮ ની અસલ.

ઉપરોક્ત ઉત્તરોત્તર ટાઈટલ ડીડઝની નકલોના અભ્યાસ ઉપરથી ફલીત થાય છે કે રાજકોટ શહેરમાં સમાવિષ્ટ ગામ મવડીના રેવન્યુ સર્વે નં.૨૫૧ પૈકીની ખેતીની જમીન એકર ૩-૧૭ ગુઠા ગામ નમુના નં.૬ હકકપત્રકના નોંધ નં.૬૯ તથા ૨૨૧ થી શ્રી પ્રેમજી પાંચાને વહેંચણીથી પ્રાપ્ત થતા તેની માલીકીની આવેલ છે.

ત્યારબાદ શ્રી પ્રેમજી પાંચાએ હયાતીમાં ઘરમેળે વહેંચણી કરતા સદરહું ખેતીની જમીન એકર ૩-૧૭ ગુઠા તેના પુત્ર શ્રી વિરજી પ્રેમજીના ખાતે કરી જેની ગામ નમુના નં.૬ હકકપત્રકના નોંધ નં.૫૩૧ થી નોંધ પ્રમાણીત થયેલ છે.

ત્યારબાદ સદરહું ખેતીની જમીન એકર ૩-૧૭ ગુઠા શ્રી વિરજી પ્રેમજીએ વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં.૪૦૮૬ તા.૦૮/૦૪/૧૯૯૨ થી શ્રી ગોરધન લવા વિગેરેને વેચાણ આપેલ છે.જેની ગામ નમુના નં.૬ હકકપત્રકના નોંધ નં.૬૬૯ થી નોંધ પ્રમાણીત થયેલ છે.

ત્યારબાદ સદરહું જમીનનો વહીવટ કરવા શ્રી ગોરધનભાઈ લવાભાઈ વિગેરેએ તા.૦૯/૦૬/૧૯૯૩ ના શ્રી આનંદ નીતીનભાઈ મહેતા તથા શ્રી દાનુભા ગુમાનસિંહ જાડેજાને કુલમુખત્યારનામુ લખી આપેલ છે.

ત્યારબાદ અધિક કલેક્ટર કચેરી, શહેરી જમીન ટોચ મર્યાદા, રાજકોટના હુકમ નં.યુએલસી/૬(૧)૪૩૮૭ તા.૧૯/૧૦/૧૯૯૩ ના હુકમ મુજબ જમીન રાખવા પાત્ર થયેલ છે.જેની ગામ નમુના નં.૬ હકકપત્રકના નોંધ નં.૬૮૪ થી નોંધ પ્રમાણીત થયેલ છે.

ત્યારબાદ સદરહું ખેતીની જમીન એકર ૩-૧૭ ગુઠાનો બીનખેતી લે-આઉટ પ્લાન રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના પત્ર નં.રૂડા/ટેક/ડેવ/મવડી/૭૪૨/૯૪ તા.૩૧/૧૨/૧૯૯૪ થી મંજૂર થયેલ છે. અને કલેક્ટર કચેરી રાજકોટના હુકમ નં.એનએ-લેરેકોક-૬૫-કેસ નં.૨૨/૯૪-૯૫/ વશી/૮૦૬ થી ૮૧૫/૯૫ તા.૪/૩/૯૫ થી બીનખેતીની મંજૂરી મળેલ છે. જેની ગામ નમુના નં.૬ હકકપત્રકના નોંધ નં.૭૫૪ થી નોંધ પ્રમાણીત થયેલ છે.આમ ગામ મવડીના રેવન્યુ સર્વે નં.૨૫૧ પૈકીની જમીન એકર ૩-૧૭ ગુઠા બીનખેતી જમીન શ્રી ગોરધનભાઈ લવાભાઈ વિગેરેની માલીકીની થયેલ છે.



॥ ૪ ॥

ત્યારબાદ સદરહું બીનખેતી જમીનના પ્લોટસ પૈકી પ્લોટ નં.૮ થી ૧૪ ની કુલ જમીન ચો.મી.આ.૧૪૫૩-૮૩ શ્રી ગોરધનભાઈ લવાભાઈ વિગેરેના કુલમુખત્યાર દરજજે શ્રી દાનુભા ગુમાનસિંહ જાડેજાએ વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં.૧૮૦૮૪ તા.૧૧/૧૨/૧૯૯૫ ના શ્રી મનોજભાઈ ત્રિભોવનભાઈ પટેલ તથા શ્રી હિતુભા કરણસિંહ જાડેજાને વેચાણ આપેલ છે.

ત્યારબાદ સદરહું જમીનનો વહીવટ કરવા શ્રી મનોજભાઈ ત્રિભોવનભાઈ પટેલ તથા શ્રી હિતુભા કરણસિંહ જાડેજાએ તા.૩૦/૦૩/૧૯૯૬ ના શ્રી આનંદ નીતીનચંદ્ર મહેતા તથા શ્રી પંકજ હિંમતલાલ પારેખને કુલમુખત્યારનામુ લખી આપેલ છે.

ત્યારબાદ સદરહું પ્લોટસ પૈકી પ્લોટ નં.૯ ની જમીન ચો.મી.આ.૩૮૮-૧૫, ચો. વા.આ.૪૬૪-૨૪ શ્રી મનોજકુમાર ત્રિભોવનભાઈ પટેલ વિગેરેના કુલમુખત્યાર દરજજે શ્રી આનંદ નીતીનચંદ્ર મહેતાએ વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં.૭૭૨૩ તા.૧૩/૧૦/૨૦૦૫ (તા.૨૮/૧૦/૨૦૦૫) ના શ્રી મનહરભાઈ નાથાભાઈ સાદરીયાને વેચાણ આપેલ છે. જેની ગામ નમુના નં.૬ હકકપત્રકના નોંધ નં.૨૯૫૩ થી નોંધ પ્રમાણીત થયેલ છે. અને જેનો ચુકસુધારાનો દસ્તાવેજ અનુક્રમ નં.૧૯૮૪૮ તા.૨૩/૧૨/૨૦૦૮ થી રજીસ્ટર થયેલ છે.

ત્યારબાદ સદરહું પ્લોટ નં.૯ ની જમીન ચો.મી.આ.૩૮૮-૧૫, ચો. વા.આ.૪૬૪-૨૪ શ્રી મનહરભાઈ નાથાભાઈ સાદરીયાએ વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં.૧૯૮૪૨ તા.૨૩/૧૨/૨૦૦૮ ના શ્રી પ્રજાબેન રમણીકલાલ ગોલને વેચાણ આપેલ છે. જેની ગામ નમુના નં.૮-અ ના ખાતા નં.૧૭૬૮, ગામ નમુનો નં.૬ હકકપત્રકના નોંધ નં.૬૫૧૭ થી નોંધ પ્રમાણીત થયેલ છે. અને સદરહું જમીનને ટી.પી. સ્કીમ લાગુ પડતા ટી.પી. નં.૨૮ (ફાફ્ટ), એફ.પી. નં.૧ આપવામાં આવેલ છે.

ત્યારબાદ સદરહું પ્લોટ નં.૯ ની જમીન ચો.મી.આ.૩૮૮-૧૫, ચો. વા.આ.૪૬૪-૨૪ શ્રી પ્રજાબેન રમણીકલાલ ગોલને વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં.૩૦૨૮ તા.૨૬/૦૪/૨૦૧૮ ના મે. અવનીશ બિલ્ડર્સ ભાગીદારી પેઢીને વેચાણ આપેલ છે. જેની ગામ નમુનો નં.૨ ના અનુક્રમ નં.૧૭૬૮ થી પેઢીનું નામ દાખલ થયેલ છે. અને જેનો ચુકસુધારાનો દસ્તાવેજ અનુક્રમ નં.૪૩૧૨ તા.૨૧/૦૬/૨૦૧૮ થી રજીસ્ટર થયેલ છે. અને સીટી સર્વે વોર્ડ નં. ટીપી-૨૮ મવડી, સીટી સર્વે નં.૧/૯ ના પ્રોપર્ટીકાર્ડમાં પેઢીનું નામ દાખલ થયેલ છે. અવનીશ બિલ્ડર્સ ભાગીદારી પેઢી સદરહું પ્લોટના માલિક થયેલ છે.

ત્યારબાદ પ્લોટ નં.૯ ની જમીન ચો.મી.આ.૩૮૮-૧૫ ઉપર બાંધકામ કરવા મે. અવનીશ બિલ્ડર્સ ભાગીદારી પેઢીએ રાજકોટ મ્યુનિ. કોર્પો. માં ઓનલાઈન એપ્લીકેશન કરતા ફોર્મ નં.ડી ડેવલોપમેન્ટ પરમીશન નં.RMC/31-08-2018/733922/01/001409 Dt.31/08/2018 થી બીલ્ડીંગ પ્લાન મંજૂર થયેલ છે. આ તમામ હકીકતો સદરહું ટાઈટલના અભ્યાસ ઉપરથી ફલીત થાય છે. આમ સદરહું મિલ્કત મે. અવનીશ બિલ્ડર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીની માલિકીની આવેલ છે. તેમજ પક્ષકાર દ્વારા અપાયેલ મૌખિક સુચના મુજબ સદરહું મિલ્કત ઉપર કોઈપણ પ્રકારની લોન લીધેલ નથી તેમ જણાવેલ છે.

...૫...

AVANISH BUILDERS
PARTNER

આથી ઉપરોક્ત તમામ હકીકતો ટાઈટલની ચકાસણી કરતા તથા આપેલ મૌખિક માહિતીના આધારે તથા શોધના આધારે કહી શકાય કે રાજકોટ શહેરમાં સમાવિષ્ટ ગામ મવડીના રેવન્યુ સર્વે નં.૨૫૧ પૈકી ની જમીન એકર ૩-૧૭ ગુઠાના રહેણાંકના હેતુ માટે બીનખેતી જમીન કે જે " અંબીકા પાર્ક " ના નામથી ઓળખાતા પ્લોટસ પૈકી પ્લોટ નં.૮ ની જમીન ચોરસ મીટર આ.૩૮૮-૧૫, ચોરસ વાર આ.૪૬૪-૨૪ મંજૂર થયેલ બીલ્ડીંગ પ્લાન સહીતની માલિકી મે. અવનીશ બિલ્ડર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીની આવેલ છે.આમ આ મિલ્કત વ્યાજબી, શંકારહિત, માર્કેટેબલ, બોજા રહીત, લોનેબલ અને ટાઈટલ કલીયર હોવાના મારા અભિપ્રાય સાથે અરજદારે આપેલ ટાઈટલવાળી ફાઈલ આજરોજ રૂબરૂ પરત આપવામાં આવેલ છે.

રાજકોટ, તા.૧૨/૧૨/૨૦૧૮



[Signature]

વી.એમ. પટેલ
એડવોકેટ

AVANISH BUILDERS

PARTNER

અરજી પહોંચ

મેલકતનું વર્ણન રે સ નં 251 પેકી, પ્લોટ નં 9, ટીપી નં 28, એકપી નં 1
 પેકી
 Search in : Mavdi/Mavdi

પહોંચ નંબર: ૨૦૧૮૩૨૬૦૧૪૬૮૫

અરજી નંબર:

૬૩૬૪

અરજી વર્ષ:

૨૦૧૮

તા: ૧૦

માહે: ડિસેમ્બર

સને: ૨૦૧૮

રજી કરનારનું નામ વિ.એ.પટેલ (એડ) શોધ

નીચે પ્રમાણે ફી પહોંચી

રૂ. પૈસા

રજીસ્ટ્રેશન ફી.....

નકલ કરવા ની ફી સાઈડ / કોલીયો.....

૦

શેરોની નકલ કરવા માટે ફી.....

ટપાલ ખર્ચ.....

નકલો અથવા યાદીઓ (કલમ ૬૪ થી ૬૭).....

૦

શોધ અગર તપાસણી.....

Year :

૨૦૧૨

૨૦૧૮

૪૫

દંડ કલમ-૨૫.....


કલમ-૩૪ (કલમ-૫૭).....

નકલ ફી કોલીયો.....

૦

ઈન્ડેક્સ-૨ ફી.....

આ સિવાયની બાબતોની ફી



કુલ એકંદરે રૂ.

૪૫

અંકે રૂપીયા પીસ્તાલીસ પુરા.

દસ્તાવેજ

નકલ

દસ્તાવેજ રજીસ્ટર ટપાલથી નીચેના સરનામે મોકલશો.

તે રજીસ્ટર ટપાલથી મોકલવામાં

કચેરીમાં આપવામાં

આવશે.

(S T Kordiya)

સબ રજીસ્ટ્રાર.
રાજકોટ - 6 - મવડી

IGR-NIC

-3081870671754969530

૧૦/૧૨/૨૦૧૮

૧૨:૦૩:૨૪ pm

AVANISH BUILDERS
 Partner
 PARTNER

અરજી પહોંચ

મેલકતનું વર્ણન રે સ નં.251 પેકી પ્લોટ નં.9 ટી પી નં.28 એફ પી નં.1
પેકી
Search in : મવડી/MAVDI

પહોંચ નંબર: ૨૦૧૮૦૨૩૦૩૭૮૪૪

અરજી નંબર:

૨૨૨૯૬

અરજી વર્ષ:

૨૦૧૮

તા: ૧૦

માહે: ડિસેમ્બર

સને: ૨૦૧૮

રજી કરનારનું નામ વી એમ પટેલ (એડ) શોધ

નીચે પ્રમાણે ફી પહોંચી

રજીસ્ટ્રેશન ફી.....	૩. પૈસા
નકલ કરવા ની ફી સાઈડ / કોલીયો.....	૦
શેરોની નકલ કરવા માટે ફી.....	૦
ટપાલ ખર્ચ.....	૦
નકલો અથવા યાદીઓ (કલમ ૬૪ થી ૬૭).....	૦
શોધ અગર તપાસણી..... Year : ૨૦૦૨ ૨૦૧૨	૬૫
દંડ કલમ-૨૫.....	૦
કલમ-૩૪ (કલમ-૫૭).....	૦
નકલ ફી કોલીયો.....	૦
ઈન્ડેક્સ-૨ ફી.....	૦
આ સિવાયની બાબતોની ફી	

કુલ એકંદરે રૂ.

૬૫

અંકે રૂપિયાપાસઠ પુરા.

દસ્તાવેજ

નકલ

દસ્તાવેજ રજીસ્ટર ટપાલથી નીચેના સરનામે મોકલશો.

ના દિવસે તૈયાર થશે અને

તે રજીસ્ટર ટપાલથી મોકલવામાં

કચેરીમાં આપવામાં

આવશે.

(A. N. Dasani)

સબ રજીસ્ટ્રાર

રાજકોટ - ૨

IGR-NIC

-6875919770108180565

૧૦/૧૨/૨૦૧૮

૧૨:૪૭:૦૭ pm

AVANISH BUILDERS
PARTNER